



Market News

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર ઘટાડાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 18400 ની નીચે છે અને સેન્સેક્સ 61739 પર છે. સેન્સેક્સે 133 અંકો સુધી લપસ્યો છે, જ્યારે નિફ્ટીએ 38 અંક સુધી ઘટ્યો છે.

જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.23 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.25 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.23 ટકા ઉછાળાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 133.91 અંક એટલે કે 0.22% ના ઘટાડાની સાથે 61739.08 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 38.40 અંક એટલે કે 0.21% ટકા ઘટીને 18365.00 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, રિયલ્ટી અને ઓયલ એન્ડ ગેસ શેરોમાં 0.06-0.44% ઘટાડાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.01 ટકા નજીવા વધારાની સાથે 42,375.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ઓટો, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતીની સાથે થતી જોવા મળી રહી છે. 1 ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 7 પૈસા વધીને 81.58 ના

સ્તર પર ખૂલ્યો છે. જ્યારે ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 81.65 ના સ્તર પર બંધ થયો હતો. Tata Motors Share Price: એક દિવસ પહેલા લગ્ગરી અને સ્પોર્ટ્સ ગાડીઓ બનાવા વાળી ટાટા મોટર્સ (Tata Motors) ની સબ્સિડિયરી જેગુઆર લેન્ડરોવર (Jaguar Land Rover-JLR) ના સીઈઓ Thierry Bollore એ પોતાના પદથી રાજીનામું આપ્યું હતું. તેની અસર આજે ટાટા મોટર્સના શેરો પર દેખાય રહી છે. ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની ટાટા મોટર્સ (Tata Motors) ના શેરોમાં આજે 17 નવેમ્બરના 2 ટકાથી વધારે ઘટાડો દેખાય રહ્યો છે. બીએસઈ પર ઈંટ્રા-ડે માં તે 419.70 રૂપિયાના ભાવ સુધી લપસી ગયા હતા. તેના માર્કેટ કેપ 1,40,373.34 કરોડ રૂપિયા છે. aytm ના શેરોમાં એકની બાદ એક ઘણી મોટી બ્લોક ડીલ થઈ છે. તેની અસર પેટીએમના શેરો પર 17 નવેમ્બરને જોવાને મળ્યા. માર્કેટ ખુલતા જ પેટીએમના શેર દબાણમાં આવી ગયા. સવારે 10:37 વાગ્યે પેટીએમના શેરની પ્રાઈઝ 9.34% ઘટીને 545.65 રૂપિયા પર હતા.

17 નવેમ્બર સવારમાં બજાર ખુલવા પર One97 Communications માં 2.95 કરોડ શેરોની બ્લોક ડીલ થઈ. આ પેટીએમની 4.5 ટકા ભાગીદારીના બરાબર છે. બ્લૂમબર્ગે આ સમાચાર આપ્યા છે. જો કે, હજુ આ શેરોને ખરીદવા અને વેચવા વાળા ઈનવેસ્ટર્સના બારમાં ખબર નથી પડી. પરંતુ, માનવામાં આવી રહ્યું છે કે સોફ્ટ બેન્કે પોતાની ભાગીદારી પેટીએમમાં વેચી હશે. વન97 કમ્યુનિકેશન્સ Paytm નામથી ફાઈનાન્શિયલ સર્વિસિઝ ઓફર કરે છે

Results & Corporate Action

Result Calendar	
Date	Company Name
22 November 2022	SIEMENS

				
Corporate Action	Company Name	Type & Percentage	Record Date	Ex-Date
BONUS	Janus Corporatio	Bonus Ratio 4:3	28-11-2022	28-11-2022
BONUS	Veer Energy	Bonus Ratio 3:10	25-11-2022	25-11-2022
BONUS	Commerl. Synbags	Bonus Ratio 2:1	25-11-2022	25-11-2022
SPLITS	Chandra Prabhu	Oldfv 2 New fv 10	-	30-11-2022
SPLITS	Mafatlal Ind	Oldfv 2 New fv 10	-	25-11-2022
SPLITS	Dev Information	Oldfv 5 New fv 10	-	25-11-2022
SPLITS	Easy Trip	Oldfv 2 New fv 1	-	21-11-2022
RIGHTS	Roni Households	Rights Ratio 1:5 FV10 premium 60	25-11-2022	25-11-2022
DIVIDEND	3M India	Special 8500	22~11~2022	21~11~2022
DIVIDEND	Balkrishna Ind	Interim 200	22~11~2022	21~11~2022
DIVIDEND	Tide Water Oil	Interim 600	22~11~2022	21~11~2022
DIVIDEND	Petronet LNG	Special 70	22~11~2022	21~11~2022
DIVIDEND	Oil India	Interim 45	22~11~2022	21~11~2022
DIVIDEND	ONGC	Interim 135	22~11~2022	21~11~2022
DIVIDEND	Bharat Forge	Interim 75	25~11~2022	24~11~2022

Nifty Spot in Last Week:-

ઉપરમાં ૧૮૪૪૨.૧૫ અને નીચામાં ૧૮૨૦૯.૮૦ નો ભાવ જોવા મળ્યો હતો.



NIFTY WEEKLY CHART



BANKNIFTY WEEKLY CHART

Nifty Spot in Upcoming Week:-

ઉપરમાં ૧૮૪૫૦ થી ૧૮૫૦૦ supply zone છે નીચામાં ૧૮૦૦૦ થી ૧૭૮૦૦ demand zone છે.

Bank Nifty in Upcoming week:-

ઉપરમાં ૪૨૬૦૦ થી ૪૨૮૦૦ supply zone છે નીચામાં ૪૧૩૦૦ થી ૪૧૦૦૦ demand zone છે.

Recommendation for next week

Serial No.	Stock Name Cash segment	Above / Below / Add HOLD	CMP as on 19.11.2022	Trail SL	Buy Stop loss	Sell Stop loss	Target
1	JUBLPHARMA(BUY)	HOLD 374	382		360		400-420
2	LEMONTREE(BUY)	ABOVE 97.00	95.65		88		125
3	JUBLINGERA(BUY)	AROUND 540	575		523		600-650

Commodity Market

COPPER:- ઘટાડે ૬૬૦ ના s1 થી ખરીદી કરી શકાય ઉપરમાં ૭૩૦ સુધી નો ભાવ આવી શકે.



CRUDEOIL:- ઉછાળે ૭૧૫૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૬૨૦૦ થી ૬૦૦૦ નો ભાવ આવી શકે.



SILVER: :- ઘટાડે ૬૦૦૦૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૬૨૫૦૦ થી ૬૯૦૦૦ નો ભાવ આવી શકે.



GOLD:- ઉછાળે ૫૩૧૦૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૫૨૦૦૦ નો ભાવ આવી શકે.



Currency Market (Cash Levels)

USDINR:- ઉછાળે ૮૨.૦૦ થી ૮૨.૫૦ ની રેન્જમાં ૮૨.૮૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૮૦.૧૫ સુધી નો ભાવ આવી શકે,ઘટાડે ૮૦.૧૫ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૮૦.૦૦ નો s1 રાખવો ઉપરમાં ૮૨.૦૦ સુધી નો ભાવ આવી શકે.



GBPINR:- ઉછાળે ૯૮.૦૦ થી ૯૯.૦૦ ની રેન્જમાં ૧૦૧.૫૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૯૫.૦૦ સુધી નો ભાવ આવી શકે,ઘટાડે ૯૫.૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૯૪.૦૦ નો s1 રાખવો ઉપરમાં ૯૮.૦૦ સુધી નો ભાવ આવી શકે.



EURINR:- ઉછાળે ૮૬.૦૦ થી ૮૭.૦૦ ની રેન્જમાં ૮૭.૮૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૮૩.૦૦ સુધી નો ભાવ આવી શકે,ઘટાડે ૮૩.૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૮૧.૦૦ નો s1 રાખવો ઉપરમાં ૮૬.૦૦ સુધી નો ભાવ આવી શકે.



JPYINR :- ઉછાળે ૬૦.૦૦ થી ૬૧.૦૦ ની રેન્જમાં ૬૧.૭૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૫૪.૦૦ સુધી નો ભાવ આવી શકે,ઘટાડે ૫૬.૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૫૪.૦૦ નો s1 રાખવો ઉપરમાં ૬૦.૦૦ થી ૬૧.૦૦ સુધી નો ભાવ આવી શકે.

Currency CASH LEVEL	DEMAND ZONE LEVEL		CLOSE	SUPPLY ZONE LEVEL	
	D2	D1		S1	S2
USDINR	80.15	80.50	81.69	82.00	82.50
GBPINR	93.00	94.00	97.33	98.00	99.00
EURINR	82.00	84.00	84.73	86.00	87.00
JPYINR	56.50	57.00	58.42	60.00	61.00

Currency Corner

Premium / Discount (USD/ INR) Based on Forward Rates	
Duration	Premium
One month Forward	0.17
Three month Forward	0.44
Six month	0.85
One year	1.65

RBI reference Rates	
Currency	Rates
USD	81.63
GBP	97.19
Euro	84.77
100 Yen	58.53

રોકાણકારો રાહુલ દ્રવિડના ક્રિકેટમાંથી પાઠ શીખી શકે છે ભાગ:2

એ સમજવું અગત્યનું છે કે રોકાણમાંથી પૈસા કમાવવા એ માત્ર બુદ્ધિનું કાર્ય નથી. વર્તણૂકના ઘણા પાસાઓ જેમ કે ફોકસ, શિસ્ત વગેરે રોકાણની સફળતા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સંદર્ભમાં, શ્રી સૌરભ મુખર્જી બતાવે છે કે રાહુલ દ્રવિડના ક્રિકેટમાંથી શું શીખવાનું છે. આ લેખ ધ ઈકોનોમિક ટાઈમ્સ પરથી લેવામાં આવ્યો છે (<https://economictimes.indiatimes.com/markets/stocks/news/lessons-investors-can-learn-from-rahul-dravids-cricket/articleshow/80381050.cms>)

જેમ જેમ વર્ષો વીતતા ગયા અને જેમ જેમ દ્રવિડ ક્રિકેટની દુનિયામાં ઉભો થયો તેમ તેમ તેની માનસિક સ્થિતિની તકનીકો ઉચ્ચ સ્તરની નિપુણતા સુધી પરિપૂર્ણ થઈ ગઈ.

રાહુલ દ્રવિડની પત્ની વિજેતા યાદ કરે છે કે લગભગ 2006-07:

જ્યારે અમે બાળકો સાથે મુસાફરી કરવાનું શરૂ કર્યું... અમે ખાતરી કરી કે અમને એકબીજાની બાજુમાં બે રૂમ મળે. દરેક મેચના આગલા દિવસે, છોકરાઓને કહેવામાં આવ્યું હતું કે તેમના પિતાને થોડા સમય માટે એકલા રહેવાનું છે, અને તે હતું. તે તેના

રૂમમાં જશે અને ધ્યાન કરશે અથવા કદાચ થોડી વિઝ્યુલાઇઝેશન કસરતો કરશે. રમતની સવારે, તે ઉઠશે અને મેદાન પર જતા પહેલા ધ્યાનનું બીજું સત્ર કરશે. મેં જાતે ધ્યાન કરવાનો પ્રયાસ કર્યો છે અને હું જાણું છું કે રાહુલ ઝોનમાં ઝડપથી પ્રવેશ કરી શકે છે કારણ કે તેને પહોંચવા માટે ઘણા વર્ષોની તાલીમ લે છે.”

અમે અત્યાર સુધી જે બધી ચર્ચા કરી છે તેનો સરવાળો તમને માત્ર એક અત્યંત કુશળ ક્રિકેટર જ નહીં, પણ જેની માનસિક સ્થિતિએ તેને માનસિક શક્તિનો પ્રચંડ ભંડાર આપ્યો છે તેની પણ કલ્પના કરવા દે છે. દ્રવિડે પોતે 2004માં ક્રિકઇન્ફો એડિટર સંબંધિત બલ માટે આપેલા ઇન્ટરવ્યુમાં આખી રચનાને એકસાથે ખેંચી હતી:

હું મેચ પહેલા છેલ્લા બે દિવસમાં શક્ય તેટલી વધુ નેટ રાખવાનો પ્રયત્ન કરું છું. જ્યારે હું મારી રમતમાં આરામદાયક અનુભવું છું, ત્યારે હું બંધ કરું છું. પછી હું મેચ વિશે વિચારવાનું શરૂ કરું છું. હું વિકેટ તરફ જોઉં છું. હું કયા પ્રકારના બોલરો રમીશ, તેમની શક્તિ અને નબળાઈઓનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીશ. તેમની સાથેની મારી છેલ્લી મુલાકાતની યાદોને હું મારા મનમાં ફરી રમું છું. જો તેઓ ઉપલબ્ધ હોય તો હું વિડિઓઝ જોઉં છું. જો છેલ્લી વખતે કોઈ બોલરે મને આઉટ કર્યો તો હું વિચારવાનો પ્રયત્ન કરું છું કે હું કેવી રીતે આઉટ થયો, મેં કઈ ભૂલ કરી. અને હું મનની શાંત સ્થિતિમાં રહેવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરું છું, કારણ કે જ્યારે હું મારા ડેસ્ક પર રમું છું. હું રમતના થોડા દિવસો પહેલા વસ્તુઓને ધીમું કરવાનો પ્રયાસ કરું છું. હું લાંબા સમય સુધી લંચ લઉં છું, અવિચારી રીતે વસ્તુઓ કરું છું. મેચની સવારે, હું હંમેશા મેદાન પર પહોંચવાના થોડા કલાકો પહેલા ઉઠું છું, જેથી મારી પાસે તૈયાર થવા માટે પુષ્કળ સમય હોય. હું નહાવા,

મારા કપડાં પહેરવા, નાસ્તો કરવા માટે મારો સમય કાઢું છું. હું ક્યારેય વસ્તુઓમાં ઉતાવળ કરતો નથી..."

વધુમાં, જેમ જેમ તેની કારકિર્દી આગળ વધતી ગઈ તેમ તેમ, ડેવિડે સાથીદારો પાસેથી પ્રતિસાદ માંગ્યો અને તેની નબળાઈઓને સમજવા માટે તેનું આત્મનિરીક્ષણ કર્યું. પછી તેણે તેની ક્રિકેટની બુદ્ધિનો ઉપયોગ કરીને આ નબળાઈઓના તકનીકી ઉકેલો શોધી કાઢ્યા અને પછી આ મુદ્દાઓને ઠીક કરવામાં નેટ પર સેંકડો કલાકો ગાળ્યા.

અંતે, તેણે ઉચ્ચ ગુણવત્તાના વિરોધ સામે લાઇવ ક્રિકેટ મેચોમાં આ ટેકનિકલ ડિક્સીસનો અમલ કર્યો.

2000-05ના ભારતીય ટીમના કોચ જ્હોન રાઈટે અન્ય લોકો સમક્ષ આની નોંધ લીધી હતી:

તેણે ક્યારેય એક જ ભૂલ બે વાર કરી નથી. તે એક-દિવસીય ક્રિકેટમાં ખૂબ જ શીખ્યો - જે કદાચ એક એવો વિસ્તાર હતો જેમાં તેણે અન્ય કરતા થોડું વધારે કામ કરવું પડતું હતું. તેને ભારતીય વન-ડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તે પછી પાછો ફર્યો હતો અને [2003માં] ખૂબ જ સારો વર્લ્ડ કપ મેળવ્યો હતો... તેની પાસે તમામ શોટ હતા, પરંતુ તેણે સ્ટ્રાઇક ઓવરને ફેરવવા માટે સખત મહેનત કરી, સિંગલ્સ મેળવ્યા, અને બોલને ઓન સાઈડ પર છોડો, જ્યારે તમે સામાન્ય રીતે તેને ઓફ સાઈડ પર મૂકી શકો છો. શરૂઆતમાં, લોકો તેને ધીમું કરવાનો પ્રયાસ કરશે, પરંતુ પછી તેણે એક રસ્તો કાઢ્યો જેથી તેઓ તે કરી શક્યા નહીં."

રાહુલ દ્રવિડ પર ઉપલબ્ધ પ્રકાશિત સામગ્રીમાં, આ કેસ સ્ટડી - દ્રવિડે તેની વન-ડે ક્રિકેટ બેટિંગ કેવી રીતે ગોઠવી તે અંગે - થોડી વિગતવાર આવરી લેવામાં આવી છે. આ ક્ષમતા - કોઈની નબળાઈઓને સમજવાની અને સ્વીકારવાની, પછી ઉકેલ શોધવાની અને છેવટે વૈશ્વિક પ્રેક્ષકોની સામે ફિક્સને અમલમાં મૂકવા માટે જરૂરી માનસિક શક્તિ - ખૂબ જ દુર્લભ છે.

તે અસંભવિત છે કે લાક્ષણિકતાઓનો આ સમૂહ વ્યક્તિમાં કોય કરી શકાય છે; તમારે આ પ્રકારે વધવા માટે વ્યક્તિની જિજ્ઞાસા અને માનસિકતાની જરૂર છે.

દ્રવિડ નાનપણથી જ વૃદ્ધિની માનસિકતા ધરાવતો હતો.

ગ્રેગ ચેપલ, જેઓ 2005-07 સુધી ભારતીય ટીમના કેપ્ટન તરીકે દ્રવિડના મોટા ભાગના કાર્યકાળ માટે ભારતના કોચ હતા, તેમણે કહ્યું:

રાહુલ એક ઉત્સુક વાચક છે, જે જ્ઞાનની શોધમાં વાંચે છે કે જેનાથી સુધારી શકાય

પોતે. તે એક બાળક જેવો છે કે તે સતત પ્રશ્નો પૂછે છે અને પછી પૂછે છે કે જ્યારે તમે તેને જવાબ આપો છો. તે રીતે, તે પ્રખ્યાત કોચબલ હતો. તે તેની બુદ્ધિમત્તા અને તેની ક્ષમતામાં દ્રઢ વિશ્વાસને કારણે ખ્યાલો લઈ શકતો હતો અને તેને ક્રિયામાં ફેરવી શકતો હતો.

દ્રવિડની પત્ની વિજેતા કહે છે કે ક્રિકેટના મેદાનમાં ભલે તે ખરાબ હોય, પણ તેની વૃદ્ધિની માનસિકતા તેને પાછા ઉછાળવામાં મદદ કરશે:

દિવસની રમતના અંતે, તે તેના વિશે વિચારી શકે છે, તેની બેટિંગ તેને પરેશાન કરી શકે છે... પરંતુ તે સમયે તે તેના જીવનને ખૂબ સારી રીતે અલગ કરી શકે છે. તે રૂમ સર્વિસ અથવા બ્લૂ ઇનડોર ઓર્ડર કરશે નહીં. તે તેના બદલે બહાર જવાનું પસંદ કરે છે, કંઈક કરવા માટે શોધે છે: મૂવી જોવા અથવા મ્યુઝિકલ્સ જોવા - જે તેને ગમે છે. તે દરિયામાં ફરશે અથવા પુસ્તકોની દુકાનો પર જશે.

ટેસ્ટ ક્રિકેટની જેમ, રોકાણમાં, સૌથી સફળ રોકાણકારો એવા હોય છે જેઓ માત્ર તેમની ટેકનિકલ કૌશલ્ય પર જ કામ કરતા નથી પણ મહાન કંપનીઓની અંતર્ગત કામગીરી વિશે પણ ઊંડાણપૂર્વક વિચારે છે. આવા રોકાણકારો પછી કંપનીઓને તે રીતે જોઈ શકે છે જે અન્ય કોઈ ન જોઈ શકે; ચોક્કસ રીતે આ રોકાણકારો આ કંપનીઓની કામગીરીની આંતરદૃષ્ટિ મેળવવા માટે સક્ષમ છે જે અન્ય કોઈ પાસે નથી.

વધુમાં, આત્મનિરીક્ષણ કરીને અને તેમના અગાઉના રોકાણના નિર્ણયોની સમીક્ષા કરીને, આવા રોકાણકારો તેમના રોકાણ ટૂલસેટમાં રહેલી ખામીઓને ઓળખવામાં સક્ષમ છે.

પછી, દ્રવિડ જેવા આ રોકાણકારો તેમની ખામીઓના ઉપાયો ઓળખવા આગળ વધે છે. મહાન રોકાણકારો, મહાન ટેસ્ટ ક્રિકેટરોની જેમ, મજબૂત ટેકનિકલ કૌશલ્યો અને વૃદ્ધિની માનસિકતાનું સંયોજન છે.

ડિસ્ક્લેમર: આ કોલમમાં વ્યક્ત કરાયેલા મંતવ્યો લેખકના છે. અહીં દર્શાવેલ તથ્યો અને મંતવ્યો અમારા વિચારને પ્રતિબિંબિત કરતા નથી

HEAD OFFICE

B/230-231, International Trade Center, Majura Gate, Ring Road, Surat-2.(Guj.) India Ph: 0261- 40 60 750, 246 27 90
Fax : 0261-246 27 91 www.markethubonline.com E-Mail : info@markethubonline.com

IA SEBI Registration no.:INA000005333

Disclaimer :

We do not represent that information provided by us is accurate or complete and it should not be relied upon as such. The advice provided here is just for knowledge purpose only. The user assumes the entire risk of any use made or not made of this information.

INVESTMENT IN EQUITY, MUTUAL FUND, EQUITY, CURRENCY & COMMODITY DERIVATIVES IS SUBJECT TO RISK. WE ARE DISTRIBUTOR OF MUTUAL FUND.

Client should read the Risk Disclosure Document (RDD) & Do's and Don'ts issued by SEBI & relevant exchanges before investing.

MARKET~HUB